

BUSINESS મિત્ર

મિડકેપ-સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ, રોકાણકારોએ રૂ. ૩ લાખ કરોડ ગુમાવ્યા

સેન્સેક્સ ૩82 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી બે મહિનાની નીચલી સપાટીએ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી અમદાવાદ, તા. 7: વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલની વચ્ચે અમેરિકાના જોબ્સ રેટા બાદ ફેરવલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવા અંગેની ચિંતાઓ વધી હોવાથી રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું અને તેના કારણે આજે સપ્તાહની શરૂઆત નરમાઈથી થઈ છે. એકબાજું મીડલ ઇસ્ટના તણાવ વધતો જાય છે, જેથી ફૂડ ઓઈલના ભાવ ઉછળતા હોવાથી રોકાણકારો નિરસ જોવાયા હતા અને મંદીવાળાઓ બજારમાં હાવી થતા જવા મળ્યા છે. જેના લીધે વેચવાલી ચાલુ થઈ ગઈ છે અને નિફ્ટીએ 23800 પોઈન્ટની સપાટી તોડી નાખતા નિફ્ટી બે મહિનાની નીચલી સપ

સેક્ટર વાઈઝ જોઈએ તો આજે આઈટી, મીડિયા, અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું, જ્યારે હેલ્થકેર અને ફાર્મા શેરોમાં સુધારો જોવાયો હતો. લાઈફકેપ શેરોની પાછળ ઘોડર માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ રહ્યું હતું. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩ લાખ કરોડનો ફટકો પડ્યો છે.

બીએસઈ સેન્સેક્સ 382.62 પોઈન્ટ એટલે કે 0.5 ટકા થટીને 71632.81 પોઈન્ટના સ્તરે બંધ રહ્યા હતા. આજે ઇન્ફોર્મીઝ સેન્સેક્સ 76477.19 પોઈન્ટના સ્તર સુધી ઉછળ્યો હતો, જ્યારે નીચામાં 75970 પોઈન્ટ સુધી ઘટ્યો હતો. નિફ્ટી 118.55 પોઈન્ટ એટલે કે 0.5 ટકા થટીને 23800 પોઈન્ટની સપાટીની નીચે સરકીને 23779.15 પોઈન્ટના સ્તરે બંધ રહી હતી. આજે ઇન્ફોર્ડમાં નિફ્ટી 23890 પોઈન્ટ સુધી ઉછળી હતી, જ્યારે

ઘરોમાં રહેલા 28,000 ટન સોનામાંથી માત્ર 8% જ ગિરવે

ભારતનું ગોલ્ડ લોન માર્કેટ 18.6 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું

પર્સનલ લોનને પાછળ છોડી ગોલ્ડ લોન ઝળી બીજી સૌથી મોટી રિટેલ કેટેગરી ; FY28 સુધીમાં રૂ. 30 લાખ કરોડનું કદ વટાવવાનો અંદાજ

નવી દિલ્હી, તા. 7: ભારતમાં ગોલ્ડ લોનનો કેહ વધતો જોવા મળી રહ્યો છે. જોને બેન્કમાંથી અન્ય લોન ઉપલબ્ધ થતી નથી, ત્યારે તેઓ ગોલ્ડ ગિરવે મુકીને લોન મેળવીને પોતાની જરૂરિયાતોને પુરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લગ્ન, વ્યવસાય, શિક્ષણ અથવા અચાનક આર્થિક જરૂરિયાતના સમયે ઘણા લોકો સોનાને વેચવાના બદલે ગિરવે મુકીને લોન લેવાનું પસંદ કરે છે. જેના કારણે આ વ્યવસાયમાં ઝડપી ઉછળી જોવા મળી રહ્યો છે.

મોતીલાલ ઓસવાલના એક અહેવાલ અનુસાર માર્ચ 2026 સુધીમાં દેશનું ગોલ્ડ લોન માર્કેટ આશરે રૂ. 18.6 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. પાંચ વર્ષ પહેલા જે

રૂપિયામાં વધારો ટક્યો નહીં, અંતે સપાટ રહ્યો

કન્સ્ટ્રી બજારમાં આજે ડોલરની સામે રૂપિયો વઢીને 94.૩6 સુધી પહોંચ્યા બાદ વેચવાલી હાવી થતાં ડોલર પરત ફર્યો હતો. અંતે ડોલર સામે રૂપિયો નજીવો સુધરીને સપાટ બંધ રહ્યો હતો. આજે ડોલરની સામે રૂપિયો એક પૈસા સુધરીને 94.49ના સ્તરે બંધ રહ્યો હતો. જે ગત સેશનમાં ડોલરની સામે રૂપિયો 94.50ના સ્તરે બંધ રહ્યો હતો. અન્ય કન્સ્ટ્રીઓમાં યુરો 109.86, પાઉન્ડ 127.67, કેનેડિયન ડોલર 68.46, ઓસ્ટ્રેલિયન ડોલર 68.02, જાપાનીઝ યેન 0.6180 અને સિંગાપોર ડોલર 74.૩9ના સ્તરે બંધ રહ્યા હતા.

નીચામાં 23737 પોઈન્ટ સુધી થટી હતી. બેન્ક નિફ્ટી 281.35 પોઈન્ટ એટલે કે 0.49 ટકા થટીને 57088.30 પોઈન્ટના સ્તરે બંધ રહ્યા હતા. આજે બેન્ક નિફ્ટી 57000 પોઈન્ટની સપાટી જાળવી રાખવામાં સફળ થઈ છે.

બીએસઈ પાટે ડ્રાયડસ વેલનેસમાં 16.94 ગણા, બજાજ હોલ્ડીંગ્સમાં 15.08 ગણા, ટીવીએસ હોલ્ડીંગ્સમાં 5.61 ગણા, ઈન્ડિયન હોટલ્સમાં 5 ગણા, સીરમા એસજીએસમાં 3.57 ગણા કામકાજ નોંધાયા છે. એનએસઈ પાટે ડ્રાયડસ વેલનેસમાં 25.86 ગણા, સીરમા એસજીએસમાં 12.49 ગણા, સીરમી આર ઓઈનોક્સમાં 4.76 ગણા, ટેગા ઈન્ડ.માં 4.66 ગણા, વોકાર્ટ લિ.માં 3.4 ગણા કામકાજ નોંધાયા છે.

બ્રોડર માર્કેટમાં પણ નિરસ વલણ જોવાયું હતું. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.59 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.03 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જેના લીધે માર્કેટ બ્રેકથ પણ નબળી રહી હતી. બીએસઈ પાટે 2018 શેરો વખા હતા, જ્યારે 2470

શેરો ઘટ્યા હતા અને 241 શેરો યથાવત રહ્યા હતા. નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ 2.86 ટકા ઘટ્યો હતો. જેમાં ઝી એન્ટર, પીવીઆર આઈનોક્સ, સન ટીવી નેટવર્ક, નેટવર્ક 18 મીડિયા, હેથલે કેબલ, ટીપ્સ મ્યુઝીક અને ડીબી કોર્પ ઘટ્યા હતા.

વૈશ્વિક સ્તરે પર્સિયન ગલ્ફમાં વધતી જતી લશ્કરી ગતિવિધિઓ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કની નીતિ બેઠકના પગલે આજે યુરોપિયન બજારો નીચા ખુલ્યા હતા. દરમ્યાન અમેરિકાના અપેક્ષા કરતા સારા જોબ્સ રેટા આવ્યા હોવાથી વૈશ્વિક વૃદ્ધિના આશાવાદ પાછળ મોટા ભાગના એશિયન બજારો સુધર્ધા હતા. જોકે, આ રેટાના કારણે યુએસના વ્યાજદર વધવાની ભીતિ સેવાતી હોજોવ મળી રહી છે.

યુરોપિયન બજારોમાં એફટીએસ 0.11 ટકા સુધારા સાથે ચાલી રહ્યા છે. જ્યારે કેક 0.01 ટકા અને રૂક્સ 0.35 ટકા ઘટાડા સાથે ચાલી રહ્યા છે. એશિયન બજારોમાં નીક્કી 1.80 ટકા,

એપલ ફોલેબલ આઈફોન લાવશે, સેમસંગને ટક્કર આપશે

20મી સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરશે

નવી દિલ્હી, તા. 7: એપલ ટૂંકસમયમાં તેનો નવ ફોલેબલ આઈફોન લોન્ચ કરી શકે છે. કંપની આગામી 20મી સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરે તેવી સંભાવના છે. જણાવ્યા અનુસાર, એપલ આગામી વર્ષ સુધીમાં વિશ્વના ફોલેબલ માર્કેટમાં 30% થી વધુ હિસ્સો મેળવી શકે છે. તેમનો અંદાજ છે કે કંપની આ વર્ષે 30 લાખથી વધુ ફોલેબલ બેચી શકે છે અને લોન્ચિંગના પ્રથમ 12 મહિનામાં આ આંકડો લગભગ 10 મિલિયન યુનિટ સુધી પહોંચી શકે છે, એટલે કે, શરૂઆતમાં મોંઘા હોવા છતાં, એપલના મોટા ગ્રાહક આધારને કારણે આ ફોન ખૂબ જ ઝડપથી લોકો ફોલેબલની કિંમત 2500 ડોલર એટલે કે 2 લાખ રૂપિયાથી વધુની રહેશે. એપલ ફોલેબલ ફોનની સામે સૌથી મોટો વાર્ષિક ઘટાડો હશે. આ સેક્ટરમાં સેમસંગ આગેવાની કરી રહ્યો છે. ત્યારે એપલના આગમનથી સેમસંગ સાથે ભારે હરિકાઈ થવાની સંભાવના છે.

સેન્સેક્સ નિફ્ટી બેન્ક નિફ્ટી	-382.62	76132.81
	-118.55	23779.15
	-281.35	57088.30
નિફ્ટી		
ટોપ ગેઇનર્સ		
કંપનીનું નામ	ટકાવારી	ભાવ
અપોલો હોસ્પિટલ	1.27	8760.00
લાઈન્ન-ટુબો	0.88	૩999.00
કોલ ઇન્ડિયા	0.84	418.85
ભારતી એરટેલ	0.76	1854.00
મેક્સ હેલ્થકેર	0.73	992.00

ટોપ લુર્ડર્સ		
કંપનીનું નામ	ટકાવારી	ભાવ
ઈન્ફોસીસ	૩.76	1087.50
એસબીઆઇ લાઇફ	2.42	1732.00
એચડીએફસી લાઇફ	2.42	533.20
વિંયો ફાઇનાન્સીયલ	2.13	234.40
ટેક મહિન્દ્રા	2.06	1564.00

સેન્સેક્સ ટોપ ગેઇનર્સ		
કંપનીનું નામ	ટકાવારી	ભાવ
લાઈન્ન-ટુબો	0.61	૩990.00
ભારતી એરટેલ	0.60	1853.00
મારુતિ સુઝુકી	0.47	12760.00
પાવરગ્રીડ	0.૩6	266.95
ICICI બેન્ક	0.35	1428.00

ટોપ લુર્ડર્સ		
કંપનીનું નામ	ટકાવારી	ભાવ
ઈન્ફોસીસ	૩.81	1087.00
ટેક મહિન્દ્રા	1.96	1560.80
ટાટા સ્ટીલ	1.85	185.50
બજાજ ફિનર્સર્વ	1.57	1940.00
અટ્લૂટેક સિમેન્ટ	1.41	11188.00

તાઈવાન 1.64 ટકા, કોસ્પી 4.41 ટકા અને શાંધાઈ 0.07 ટકા સુધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે જકાર્તા 0.25 ટકા, હૉન્ગકોંગ 1.01 ટકા અને સ્ટ્રેઈટ્સ 0.17 ટકા ઘટાડા સંતે બંધ રહ્યા હતા.

સુભાષ ચંદ્રા સામે ઠગાઈની ફરિયાદ દાખલ થતાં તેઓ દેશ છોડીને જઈ નહીં શકે

ભારતની બેન્કો તેમ જ નાણાં સંસ્થાઓને ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો યુનો લગાવીને વિદેશ ભાગી જવાની સુભાષ ચંદ્રાની યોજના પર સરકારના પોપટ ગણાતાં સીબીઆઈએ રોક લગાવી છે.

NCLT દ્વારા સુભાષ ચંદ્રાનું ૨૨,૦૦૬ કરોડ રૂપિયાનું દેતું માત્ર ૬.૨૫ કરોડ રૂપિયામાં સેટલ કરવાના સુકાદા પછી દેશભરના મીડિયામાં જે ચકચાર મચી ગઈ તેને કારણે સરકારને સુભાષ ચંદ્રા સાથે ઘટવમાઈ જેવું વર્તન બંધ કરવાની અને કડક પગલાં લેવાની ફરજ પડી છે. આ ફરજના ભાગરૂપે પહેલાં NCLT દ્વારા સુભાષ ચંદ્રા સામેની અપીલ દાખલ કરવામાં આવી અને હવે સીબીઆઈ દ્વારા તેમની પર ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે સુભાષ ચંદ્રાની દેશ છોડીને સ્વિઝર્લેન્ડમાં સ્થાયી થઈ જવાની યોજના પર પાછી ફરી વળશે. એલઆઈએ હાઉસિંગ ફાઇનાન્સની ફરિયાદના આધારે, સીબીઆઈએ ચંદ્રા અને એરસેલ ગ્રુપની કંપનીઓ સામે એફઆઈઆર દાખલ કરી છે. NCLTના નિર્ણય પછી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં સુભાષ ચંદ્રા અને એરસેલ ગ્રુપની ત્રણ કંપનીઓ અને તેમના ડિરેક્ટરો પર ૧,૩૨૨ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

FIARમાં અજાણ્યા સરકારી અધિકારીઓનાં નામ પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યાં છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે સુભાષ ચંદ્રા વિદેશ ભાગી શકે છે. તેમાં FIARની જરૂરિયાતનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે આરોપીએ જાહેરમાં ઘણી વખત ભારત છોડવાનો પોતાનો ઘરાદો જાહેર કર્યો છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, સુભાષ ચંદ્રાએ ૫૦૦ કરોડ અને ૪૮૦ કરોડ રૂપિયાની લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી હતી. આ સંદર્ભમાં રજૂ કરાયેલા એક નેટવર્થ પ્રમાણપત્રમાં તેમની કુલ સંપત્તિ આશરે ૫૯,૧૧૩ કરોડ રૂપિયા દર્શાવવામાં આવી હતી, જ્યારે બીજાં પ્રમાણપત્રમાં ૪૦,૫૬૨ કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યા હતા. બોંકે, ત્યારબાદની વ્યક્તિગત નાદારીની કાર્યવાહી દરમિયાન, ચંદ્રાએ આ કુલ સંપત્તિ હોવાનો ઘનકાર કર્યો હતો અને ૨૦૨૪ માં માત્ર ૩૧.૭૯ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ દર્શાવી હતી.

લોન મંજૂર કરવા અને વિતરિત કરવામાં આવ્યાં હતાં. આ ફરિયાદના આધારે દાખલ કરાયેલા કેસમાં સીબીઆઈને બેન્ક શંકા છે કે સુભાષ ચંદ્રાએ હજારો કરોડની નેટવર્થ દર્શાવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા અને લોન મંજૂરીમાં તત્કાલીન એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી. બનાવટી દસ્તાવેજોના આધારે લગભગ એક હજાર કરોડની લોન લેવી રીતે આપવામાં આવી? સુભાષ ચંદ્રા ઉપરાંત, વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર પંકજ જુહોલિયા, પેન ઇન્ડિયા ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, ડિવિટલ સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ એન્ડ કન્સલ્ટન્ટ્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર અમીશ પંડ્યા, સ્પિરિટ ઇન્ફ્રાપાવર એન્ડ મલ્ટિવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર રાજીવ ઘોળકિયા અને અજાણ્યા જાહેર સેવકો, તથા અન્યોનાં નામો FIARમાં આપવામાં આવ્યાં છે. આ બધી કંપનીઓ સુભાષ ચંદ્રા સાથે બેંડાયેલી છે, જેમને અબજો રૂપિયાની લોન આપવામાં આવી હતી.

એરસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાએ બુદ્ધિવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા તેમના વિરુદ્ધ વ્યક્તિગત નાદારી કેસની સુનાવણી માટે પાંચ સભ્યોની બેચ રચવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ટ્રિબ્યુનલ પાસે આવી બેચ રચવાનું કોઈ અધિકારક્ષેત્ર નથી. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) સમક્ષ સુભાષ ચંદ્રા વતી હાજર રહેલા પ્રાઇવેટ લિમિટેડ અને તેમની NCLTના આદેશને ભૂલભર્યો અને ખોટો ગણાવ્યો અને કહ્યું કે પાંચ સભ્યોની બેચ રચવાનું તેનું કોઈ અધિકારક્ષેત્ર નથી.

સુભાષ ચંદ્રાએ તેમની સંપત્તિ વિશાળ નેટવર્થના આધારે, LIC HFL એ તેમની કંપનીઓને ૧,૩૨૨ કરોડથી વધુની લોન આપી હતી. જ્યારે એસ્સેલ ગ્રુપની કંપનીઓ તેમની લોન ચૂકવવામાં નિષ્ફળ ગઈ, ત્યારે સુભાષ ચંદ્રા સામે નાદારીની કાર્યવાહી શરૂ

૨૦૧૪-૧૫ અને ૨૦૨૩-૨૪ વચ્ચે ભારતની બેંકોએ ૧૬.૩૫ લાખ કરોડ રૂપિયાના NPA માંડી વાળ્યા હતા, જેમાંથી ૯.૨૮ લાખ કરોડ મોટા ઉદ્યોગો અને સેવાઓ સાથે સંબંધિત હતા

ગુજરાતમિત્ર ટચૂકડી મિલકત વ્યવસાયિક લેવાકીય વુલન સ્ટેટર, રેઈનકોટ, ઈનર, થર્મલ, જેકેટ, ગંજી, જાંગીયા, મોજા, બ્લેઝર, ટ્રેક- પેન્ટ, ટી- શર્ટ, ખોલવડવાલા, લીમડાચોક, ડબગરવાડ, સુરત CM PEST CONTROL લાઈઝ ટાઈમ પાત્રીપૂર્વક ઉધઈની ટ્રીટમેન્ટ. 9377672958/ 9374726017 PRESIDENT PEST CONTROL 35 વર્ષથી ચાલતું એવોર્ડથી સન્માનિત લાયસન્સ 9825819250 ઘરબેઠા તાત્કાલિક LED રીપેરીંગ. ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, રીમોટ. વિનોદ રેડિયો, લાલદરવાજા. 9328436184. અગત્યની સુચના : ટચુકડી જાહેરખબરમાં પ્રસિધ્ધ થયેલી માહિતી અંગે વાચકે પુરતી ચકાસણી કરી લેવા વિનંતી. જાહેર ખબરની વિગતોની સત્યતા અંગેની અખબારની જવાબદારી રહેશે નહીં.	૩૧-૦૫-૨૦૨૨ થી લાગુ	જુના બંધ હાલતમાં	Dinesh Tours N Travels	પાર્ટ ટાઇમ જોબ
ગુજરાતમિત્ર ભવન, સોની કોઈલા, સુરત. ફોન : ૨૫૬૬૯૨૧ ફેક્સ : ૨૫૬૯૯૭૦	૩૧-૦૫-૨૦૨૨ થી લાગુ	2- બ્હીલર, 4-બ્હીલર, તથા AC વેચવા માટે સંપર્ક કરો - 9427178600	નવેમ્બર - ડિસેમ્બર પેકેજ @ કરાલા - રામેશ્વરમ - મદુરાઈ - કન્યાકુમારી. દિ. ૧૦ કશ્મીર @ અમૃતસર. દિ. ૧૦ @ દાર્જીલિંગ - લાંચુંગ - પેલિંગ - ગંગટોક. દિ. ૯ આરામદાયક હોટલ બ્રેક્ફાસ્ટ - ડિનર સહિત વધુ માહિતી માટે સંપર્ક કરો :- ૯૦૩૩૯૮૭૦૨૮, ૯૮૭૯૯૭૭૦૨૮, ૯૪૨૬1૦૨૩૫૮	સિટી લાઈટમા ઓફિસ વર્ક ભણતા સ્ટુડન્ટો માટે વાંચવાનો પુષ્કળ સમય ૧૦ થી ૩ અને ૩ થી ૪ 8980744488
		મિલ્કત વેચવાની છે		જોઈએ છે.
		અડાજણમાં		કંપની માટે નીચે જણાવેલ લોકેશન્સ પર સ્ટાફ એચઆર મેનેજર, એચઆર એક્ઝિક્યુટિવ,રિસેપ્શનીસ્ટ, માર્કેટીંગ મેનેજર, માર્કેટીંગ એક્ઝિક્યુટિવ ડિજિટલ માર્કેટીંગ મેનેજર, આઈટી એક્ઝિક્યુટિવ, બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ, ટેલિકોલર્સ, ગ્રાફિક ડિઝાઈનર, કાઉન્સેલર, બેક ઓફિસ એક્ઝિક્યુટિવ,રસોઈ માટે માસી / કુક સુરત (સિનેમા રોડ, અડાજણ, વેસુ, વરાછા), વલસાડ, ભરૂચ, વગેરતા, બારડોલી, અડાજણ RJD ઈચ્છાપોર. મો. નં. 9904064499 ફોન કરવાનો સમય 11 થી 7
		વ્યવસાયીક ચાખા-પ્રવાસ	નોકરી વિષયક	
		હિમાલયા હોલીડે	જોઈએ છે	
		ટોપ લોકેશન પર 50,000 ભાડાની આવકવાળી જખો દુકાન વેચવાની છે. 9157622115	ગોડાઉનમાં કામ કરી શકે તેવા છોકરાઓ પગાર 13,000 થી 15,000 શોભન ઈલેક્ટ્રીકલ્સ માટે મળી) Mo- 9427803273/ 9825142005 (બુર્ડીંગની છેલ્લી તારીખ- 16/09/2026)	
		વ્યવસાયીક ચાખા-પ્રવાસ	નોકરી વિષયક	
		હિમાલયા કડાંવાલા	30 વર્ષ જૂના જાણીતા	
		કડાં, તોડફોડ કર્યા વગર, અમેરીકન ટેકનોલોજીથી ગેરન્ટેડ ફિટીંગ. Mobile: 9099663638	રાજુમોદી ટિવાળીમાં રેરેલા, કન્યાકુમારી, રામેશ્વર , કોડાયકેનાલ, 13- દિવસ, 9374512979 (9 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ) (૩૦4)	

અગત્યની સુચના : ટચુકડી જાહેરખબરમાં પ્રસિધ્ધ થયેલી માહિતી અંગે વાચકે પુરતી ચકાસણી કરી લેવા વિનંતી. જાહેર ખબરની વિગતોની સત્યતા અંગેની અખબારની જવાબદારી રહેશે નહીં.

કરવામાં આવી હતી. ચંદ્રાએ દાવો કર્યો હતો કે લોન લેતી વખતે તેમણે LIC HFL ને જે પ્રમાણપત્રો રજૂ કર્યા હતા તે તેમની સંપત્તિ કચારેય એટલી ઊંચી નહોતી. ૨૦૨૪માં તેમની વાસ્તવિક કુલ સંપત્તિ માત્ર ૩૧.૭૯ કરોડ રૂપિયા જ હતી.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) લોન કેસમાં એરસેલ ગ્રુપના ચેરમેન ડો. સુભાષ ચંદ્રાનું નિવેદન બહાર આવ્યું છે. ડો. સુભાષ ચંદ્રાએ કહ્યું કે અમે અમારી સંપત્તિ વેચીને અમારી જવાબદારીઓ ચૂકવી દીધી છે. કેટલાક લોકો મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ૨૨,૦૦૦ કરોડ રૂપિયાની વ્યક્તિગત લોન અંગે મીડિયામાં જે અહેવાલો આવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે.ડો. ચંદ્રાએ એ પણ સ્પષ્ટતા કરી કે તેમણે કોઈ પણ લેણદાર પાસેથી વ્યક્તિગત રીતે કોઈ લોન લીધી નથી, તેઓ ફક્ત તેમના વ્યક્તિગત ગેરંટીર રહ્યા છે. અમે દરેક ખેસર ચૂકવવા તૈયાર છીએ. અમે અમારી સંપત્તિ વેચીને અમારી જવાબદારીઓ ચૂકવી દીધી છે.

ડો. સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે લેણદારો પાસે ફક્ત ૩,૯૯૨ કરોડ રૂપિયાના વ્યક્તિગત ગેરંટી દાવા છે. આમાંથી ૬૨૦ કરોડ રૂપિયાનું સમાધાન થયું છે. વધુમાં, લેણદારોને ૧,૦૬૩ કરોડ રૂપિયાની સમાધાન ઓફર કરવામાં આવી છે. પરિણામે, કેસનું કુલ મૂલ્ય આશરે ૨,૦૦૦ કરોડ રૂપિયા છે, જે મીડિયામાં ૨૨,૦૦૦ કરોડ રૂપિયા તરીકે અહેવાલ છે. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ સુધીમાં, તેમની કંપનીઓ પાસે આશરે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનું બાકી લેણું હતું.

RBI ના ડેટા અનુસાર, ૨૦૧૪-૧૫ અને ૨૦૨૩-૨૪ વચ્ચે બેંકોએ ૧૬.૩૫ લાખ કરોડ રૂપિયાના NPA માંડી વાળ્યા હતા, જેમાંથી ૯.૨૮ લાખ કરોડ મોટા ઉદ્યોગો અને સેવાઓ સાથે સંબંધિત હતા. અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે બેંકોનાં પાતામાં કોઈપણ લોન માંડી વાળવાનો અર્થ એ નથી કે દેવાદારની જવાબદારી સમાપ્ત થઈ ગઈ છે. બેંક કાં તો તેના ખાતામાંથી લોન રકમ કાઢે છે અથવા તેને ખરાબ માને છે, પણ વસૂલાતના પ્રયાસો અને કાનૂની કાર્યવાહી ચાલુ રહે છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે યાચ છે કે જો મોદી સરકારે પાછલી સરકાર દરમિયાન વહેંચવામાં આવેલી લોનમાં અનિયમિતતા શોધી કાઢી હતી અથવા દેવાદારો ચૂકવણી કરી શક્યા ન હતા, તો તેણે વસૂલાત માટે શું કર્યું? આ માંડી વાળેલી રકમમાંથી કેટલી ર